

સપ્ટેમ્બર 19, 2018

બ્રામ્પટનમાં કલ્ચરલ ડેઝની (સાંસ્કૃતિક દિવસોની) ઉજવણી

બ્રામ્પટન, ઓન્ટેરિયો – કલ્ચરલ ડેઝ, સપ્ટેમ્બર 28-30 દરમિયાન બ્રામ્પટનમાં રચનાત્મક (ક્રિએટિવ) બનો, સ્થાનિક કળાકારોને મળો, અને કળા અને સંસ્કૃતિ વિશે શીખો. સીટી ઓફ બ્રામ્પટન, બ્રામ્પટન લાઇબ્રેરી, PAMA (પામા), અને રચનાત્મક સમુદાય આપણાં શહેરની ગતિશીલ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક સમુદાયની ઉજવણી કરવા શ્રેણીબદ્ધ મફત જાહેર પ્રસંગો, પરફોર્મન્સીસ (પ્રસ્તુતિઓ) અને વર્કશોપ્સના યજમાન બનશે.

શહેરભરના સ્થળોએ સંગીત, નૃત્ય, કવિતા, વિઝ્યુઅલ આર્ટ (દૃશ્યમાન કળા), સાંસ્કૃતિક પ્રદર્શનો અને ઘણાં બધાં આયોજનોનો અનુભવ કરો. રહેવાસીઓને સ્થાનિક કળાકારો સાથે જોડાવવા અને સમગ્ર કુટુંબ ત્વરિત અનુભવી શકે તેવી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. સમગ્ર આયોજનની યાદી માટે વેબસાઇટ brampton.ca/culturedays જુઓ.

આ વર્ષે કલ્ચરલ ડેઝના ભાગ તરીકે, બ્રામ્પટન નવી સાર્વજનિક કળા શરૂ કરશે, જેને ગયા વર્ષે આલ્ડરલીની 150^{મી} વર્ષગાંઠના માનમાં શરૂ કરવામાં આવી હતી. કળાકાર ટિમ ડેસકલાઉડ્સે મેન્ટલ બેન્યના સ્વરૂપમાં શિલ્પ બનાવ્યું છે, ફોર ધી લવ ઓફ એ લાઉસ શીર્ષકનું, જે ઐતિહાસિક ઈમારતના ધોરણે સ્થિત હશે. આ કળાકાર ઔપચારિક અનાવરણ માટે સપ્ટેમ્બર 29 નાં રોજ સવારે 11 વાગ્યે રૂબરૂમાં હાજર રહેશે.

અવતરણ (ક્વોટ):

“કલ્ચરલ ડેઝ એ બ્રામ્પટનમાં પ્રચંડ પ્રતિભા અને રચનાત્મકતાને જાહેરમાં દર્શાવવાની એક મોટી તક બની રહે છે. હું દરેક વ્યક્તિને આ મનોરંજન, મફત પ્રવૃત્તિઓમાં સહભાગી થવા, આપણાં સ્થાનિક કળાકારો, લેખકો અને સંગીતકારો વિશે વધુ માહિતી મેળવવા, અને તમારી પોતાની રચનાત્મક બાજુને શોધી કાઢવા પ્રોત્સાહિત કરું છું.”

- મેયર લિન્ડા જેફ્રી (Mayor Linda Jeffrey)

કલ્ચરલ ડેઝ (સાંસ્કૃતિક દિવસો) વિશે

પોતાની 8^{મી} વર્ષગાંઠમાં, કલ્ચરલ ડેઝની ઉજવણી એક સમુદ્રતટથી બીજા સમુદ્રતટ સુધી સેંકડો શહેરો અને નગરોમાં કરવામાં આવશે, વિશાળ શ્રેણીના વિષયોને આવરી લેતી હજારો મફત પ્રવૃત્તિઓ સાથે જેમાં સામેલ છે: વિઝ્યુઅલ આર્ટ્સ (દૃશ્યમાન કળા), સંગીત, નૃત્ય, થીયેટર, આર્કિટેક્ચર, વારસો, ફિલ્મ અને વીડિયો, સાહિત્ય, રાંધણ કળા અને નવું મીડિયા.

સમગ્ર કેનેડાને આવરી લેતા સમુદાયોમાં કળાકારો, સાંસ્કૃતિક સંસ્થાઓ અને નગરપાલિકાઓ દ્વારા આયોજીત હજારો મફત પ્રવૃત્તિઓ અને પરફોર્મન્સીસમાં લાખો કેનેડિયનો પ્રવૃત્તમય થાય છે. નુનાવુટથી માંડીને ન્યુ બ્રાન્ઝિક, અને બ્રિટિશ કોલંબિયાથી માંડીને બાફિન આઈલેન્ડ સુધી – અને વચ્ચેના તમામ સ્થળોએ – અમે કેનેડિયન સંસ્કૃતિની રચનાને પ્રતિબિંબિત કરતી તમામ પ્રેરણા, કળા કૌશલ્ય અને અભિવ્યક્તિ વહેંચીએ છીએ. કલ્ચરલ ડેઝનું રાષ્ટ્રીય જાગૃકતા અભિયાન સપ્ટેમ્બરના છેલ્લા શુક્રવારથી શરૂ થતી ત્રણ-દિવસીય કળાની ઉજવણીની પરાકાષ્ટાએ પહોંચે છે.

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફેકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈકલ્પિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મીડિયા સંપર્ક :

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા રિલેશન્સ

સીટી ઓફ બ્રામ્પટન

905.874.3654 | natalie.stogdill@brampton.ca